

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૮/૧/૨૦૧૫ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધીધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૮/૧૫

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૫ કેસ કરી ૧૨ વ્યક્તિઓને ઝડપી ૫૪ લીટર દેશી દારૂ અને ૦૧ બોટલ ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૯/૧૫

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહિ ૯૩ મુજબ ૦૭ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

લુંટ :-

સમાચાર યાદી નં.૬૦/૧૫

ઇસનપુર : વિનોદભાઈ ઇશ્વરભાઈ પરમાર (રહે.વસંતવિહાર સોસાયટી, પાણીની ટાંકી પાસે, નારોલ જુની કોર્ટ સામે, વટવા) એ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૭/૧/૧૫ નાં કલાક ૦૦/૩૦ વાગ્યાના સુમારે નારોલ સર્કલ, ઇસનપુર ચાર રસ્તા તરફ જતાં રોડ ઉપર આવેલ બાલકૃષ્ણ ટેક્સ્ટાઇલ્સ ફેક્ટરીનાં ઝાંપા સામે બે અજાણ્યા પુરૂષ (૨૫ થી ૩૦ વર્ષના આશરનાં) ભેગામળી વિનોદભાઈનાં બિસ્સામાંથી રોકડ રૂપિયા ૨૫૦૦/-, સેમસંગ મોબાઇલ, મોટર સાયકલ અને એ.ટી.એમ.સેન્ટરમાંથી રૂપિયા ૪૦૦/- ઉપાડી લઇ, કુલ રૂપિયા ૨૪,૯૦૦/- મતાની લુંટ કરી નાસી ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.ડી.રાતડા ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૬૧/૧૫

નરોડા : મેહુલભાઈ જેરામભાઈ દેસાઈ (રહે.વસંતનગરનાં છાપરાં, ભાગ્યોદય હોટલ પાછળ, ઠક્કરનગર, નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે. તા.૭/૧/૧૫ નાં કલાક ૨/૦૦ થી ૨/૩૦ વાગ્યા દરમ્યાન એક કાળા રંગની ઇનોવા કાર(જેનો નંબર જાણવા મળેલ નથી) માં બેસી આવેલ અજાણ્યા ઇસમોએ મેહુલભાઈના ઘર નજીક આવેલ શેડમાંથી ગાય- ૦૨, વાછડી-૦૨ કિંમત રૂપિયા ૯૨,૦૦૦/- ચોરી કરી, કારમાં ભરી લઇ ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.આર.વાઘેલા ચલાવે છે.

ઓઢવ : અનિલભાઇ વાઘુભાઇ રબારી (રહે.રબારીવાસ, ઢાટકેશ્વર બસ સ્ટેન્ડ સામે, અમરાઇવાડી) ઁ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોઢાવી છે. તા.૭/૧/૧૫ બપોરનાં ૩/૪૦ વાઝ્યાનાં સુમારે ઓઢવ આદર્શ સ્ટેશનરી દુકાનનાં કાઉન્ટર પાસે પોતાની બેગ કે જેમાં બેલેન્સ કુપનો તેમજ રોકડ રૂપિયા ૯૦,૦૦૦/- ભરેલ હતા, જે કાઉન્ટર નીચે મુકી ઉભા હતા દરમ્યાન કોઇ અજાણી વ્યક્તિ અનિલભાઇની બેગની ચોરી કરી લઇ ગઇ હતી. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી આર.આર.વાઘેલા ચલાવે છે.

વાઢન ચોરી:-

સમાચાર યાદી નં.૬૨/૧૫

અમરાઇવાડી : જીતુભાઇ જગદીશભાઇ ખટીક(મારવાડી) (રહે.સંજયચોક, શંકરપુરની ચાલી, નાગરવેલ, અમરાઇવાડી) ઁ અમરાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોઢાવી છે કે તા.૬/૧/૧૫ રાતના ૧૧/૦૦ વાઝ્યાના સુમારે પોતાના ઘર નજીક બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે.૦૧.ડી.ટી.૫૧૯૩ કિમત રૂપિયા ૩,૫૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની કોઇ અજાણી વ્યક્તિ તા.૭/૧/૧૫ સવારના ૪/૩૦ વાઝ્યા દરમ્યાન ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ અમરાઇવાડી પોલીસ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૬૩/૧૫

નરોડા : જશવિરસિંહ હરવાનસિંહ મહેરા (ઉ.વ.૨૧)(રહે.અક્ષર પુરુષોત્તમ બસ સ્ટેન્ડ, ઓઢવ) તથા પ્રિયંકા સુરેશભાઇ (ઉ.વ.૨૦)(રહે.જનતાનગર, નિકોલ રોડ, ઓઢવ) તા.૭/૧/૧૪ સાંજના ૭/૦૦ વાઝ્યાના સુમારે અગમ્ય કારણસર નરોડા, હોટલ ચંદ્રવિલાસ નાં રૂમ નંબર ૨૧૧ માં ઝેરી દવા પી ગયા બાદ, પંખા સાથે દુપટ્ટો બાંધી બંને જણાઁ ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોઢી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી ઁન.ડી.અસારી ચલાવે છે.

કાગડાપીઠ : હિરલબહેન રમેશભાઇ ઠાકોર (ઉ.વ.૧૭)(રહે.પીરાવાળી ચાલી, બોરડીમીલ કંમ્પાઉન્ડ, રાયપુર દરવાજા બહાર) ઁ તા.૭/૧/૧૫ સાંજના ૪/૦૦ વાઝ્યા પહેલા કોઇપણ સમયે કોઇ અગમ્ય કારણસર પોતાના ઘરે ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોઢી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી બી.ઁલ.રોહીત ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર
પોલીસ કમિશનર વતી.